

કોવિડ-19 (Covid-19) કિસ્સાઓ ઉપર આધારિત પબ્લિક હેલ્થ ટીમ દ્વારા અઠવાડિક નિવેદન

26 ઓગસ્ટ 2021

20 ઓગસ્ટના રોજથી સાત દિવસો સુધીમાં (કે જેનો આધાર 25 ઓગસ્ટના પ્રસિધ્ધ થયેલ ડેટા- માહિતી ઉપર રાખવામાં આવે છે) બ્રાઈટન અને હોવમાં (Brighton & Hove) અમારે કોવિડ-19 ના (COVID-19) નવા 1277 કન્ફર્મ્ડ કે સમર્થિત કિસ્સાઓ થવા પામ્યા હતાં. આ છે:

- અગાઉના સાત દિવસોથી 1.7% નીચા
- કે જે 100,000 રહેવાસીઓ દીઠના સમાનાર્થ કે તુલ્ય અઠવાડિક દર પ્રમાણે 438 કહેવાય
- સાઉથ ઈસ્ટ (South East) માટેના કરતાં વધારે ઊંચા કે જે 100,000 દીઠ 318 હતાં
- ઈંગ્લેન્ડ (England) માટેના કરતાં વધારે ઊંચા, કે જે 100,000 દીઠ 328 હતાં

બ્રાઈટન અને હોવ (Brighton & Hove) માટે આનો અર્થ શું થાય?

અનુક્રમે આવતા બીજા અઠવાડિયે પણ, આપણે કોવિડ-19 ના (COVID-19) નવા સમર્થિત કે કન્ફર્મ્ડ કેસીસની સંખ્યામાં ખૂબજ થોડીક સંખ્યાની ટકાવારીમાં ફેરફાર જોયો છે. આપણે આત્મવિશ્વાસ કે કોન્ફિડન્સ બની શકીએ નહિ અને આનો અર્થ એવો થાય કે બ્રાઈટન અને હોવમાં (Brighton & Hove) ચેપનું પ્રમાણ- દર ટોચે પહોંચ્યું છે. સાઉથ ઈસ્ટ (South East) અને ઈંગ્લેન્ડના (England) બાકીના ભાગોમાં સંખ્યાઓ વધવાની ચાલુ રહી છે.

કોવિડ-19 નો (COVID-19) ચેપ પુખ્ત વયના સમુદાયો અને ટીનેજર્સ કે કિશોરોમાં હજી પણ સૌથી વધારે રહ્યો છે અને પેઢીઓના (જનરેશન) બધી ઉંમર- વયના જૂથોને અસર કરી ફેલાઈ રહ્યો છે. છેલ્લા અઠવાડિયે 60s વર્ષની ઉપરના સમુદાયમાં બીજો વધારો રહ્યો છે, અને સાઉથ ઈસ્ટમાં (South East) આપણી પાસે હવે આ ઉંમરના જૂથમાં સૌથી વધારે ચેપનું પ્રમાણ રહ્યું છે.

હોસ્પિટલમાં કોવિડ-19 ના (COVID-19) 20 કરતાં વધારે સ્થાનિક દરદીઓ છે પણ NHS વેક્સિનેશનનો પ્રોગ્રામ આ વર્ષની શરૂઆતમાં આપણે જે ખૂબજ ગંભીરરીતે બીમાર દરદીઓની સંખ્યામાં થતો ઉછાળો જોયો હતો તે રોકવામાં સફળ રહ્યો છે.

વેક્સિનેશન સેન્ટર 16-17 વર્ષની ઉંમરનાઓ માટે ખુલ્લુ અને સ્થળાંતર થઈ રહ્યું છે

હવે પછીના સોમવારે તારીખ 30 ઓગસ્ટના રોજ બ્રાઈટન અને હોવનું (Brighton & Hove) વેક્સિનેશન સેન્ટર ચર્ચીલ સ્ક્વેર શોપીંગ સેન્ટરમાં (Churchill Square shopping centre) આવેલ અગાઉના ટોપશોપ સ્ટોરમાં (Topshop store) સ્થળાંતર કરશે.

આવી આ એકજસરખી ટીમ દરરોજ સવારના 8.30 થી સાંજના 8 સુધી વેક્સિનેશન્સ ડિલિવર કરશે કે આપણે, કે જેમાં [બુક થયેલ એપોઈન્ટમેન્ટો](#) અને ચાલીને જઈ શકાય તેવી વોક ઈન સર્વિસ એમ આ બન્ને ઓફર કરશે, (કે જે દરરોજ સાંજના 7 વાગ્યા સુધી મળી રહેશે).

ધ ચર્ચીલ સ્ક્વેર (The Churchill Square) વેક્સિનેશન સેન્ટર 16 અને 17 વર્ષની વયનાઓ માટે ચાલીને જઈ શકાય તેવી વોક ઈન વેક્સિનેશન એપોઈન્ટમેન્ટો ઓફર કરશે.

વેક્સિનેશન મેળવનારાઓ દરેકેદરેકને માટે રિજન્સી રોડ ઈસ્ટમાં (Regency Road East) આવેલ ઓરેન્જ કાર પાર્ક ચર્ચીલ 1 (Churchill 1), ચર્ચીલ સ્ક્વેર શોપીંગ સેન્ટર (Churchill Square shopping centre) દ્વારા એક કલાક માટે મફત કાર પાર્કિંગ મળી રહેશે.

Gujarati

પુખ્તવયનાઓ માટે ચાલીને જઈ શકાય તેવી વોક - ઈન વેક્સિનેશન સેશનો શહેરની આસપાસમાં આવેલ બીજા સ્થળોએ ચાલુ છે કે જેમાં સમાવેશ થાય છે હોવ લોન્સ (Hove Lawns), સેન્ટ પીટર્સ ચર્ચ (St Peter's Church), ધ રેઈનબો હબ (Rainbow Hub) અને રેસકોર્સમાં (Racecourse), તમે જઈ અને તમારું વેક્સિનેશન લઈ શકો તેવી બધીજ જગ્યાઓના સ્થળો (લકેશન), તારીખો અને સમયની યાદી [ધ સસેક્સ હેલ્થ એન્ડ કેર](#) વેબસાઈટ ઉપર રહેલ છે.

સોમવાર તારીખ 30 ઓગસ્ટના રોજ અથવા તે પછી બ્રાઈટન સેન્ટરમાં (Brighton Centre) બુક થયેલ એપોઈન્ટમેન્ટોવાળા લોકોનો નેશનલ બુકીંગ સર્વિસ (National Booking Service) દ્વારા આવા લકેશન કે સ્થળમાં થયેલ ફેરફાર વિષે સીધો સંપર્ક કરવામાં આવી રહેલ છે. તેઓની એપોઈન્ટમેન્ટની તારીખ અને સમય એકજ સરખા રહેશે, ફક્ત સ્થળમાં (વેન્યુ) ફેરફાર થશે.